



**પુર્ણા International School**  
Shree Swaminarayan Gurukul, Zundal

*Grade - VII*

*Gujarati*

*Specimen*

*copy*

*Year- 2021-22*

# અનુક્રમણિકા

ક્રમ	એકમ	પૃષ્ઠ
5	શરદીનાં પ્રતાપે	2

## પાઠ- 5. શરદીનાં પ્રતાપે

- (હાસ્યકથા) જ્યોતીન્દ્ર દવે

### ➤ અઘરા શબ્દો

- |             |             |
|-------------|-------------|
| 1) સદગૃહસ્થ | 2) ઈન્દ્રિય |
| 3) કંઠ      | 4) પક્ષપાત  |
| 5) અશક્ત    | 6) તસ્દી    |
| 7) કોકો     | 8) ડોકું    |

### ➤ શબ્દાર્થ

- |             |   |                                   |
|-------------|---|-----------------------------------|
| 1) સદગૃહસ્થ | - | સજ્જન                             |
| 2) ઈન્દ્રિય | - | વિષયનું જ્ઞાન કરાવનાર શરીરનું અંગ |
| 3) કંઠ      | - | ગળું                              |



- |    |         |   |                     |
|----|---------|---|---------------------|
| 4) | પક્ષપાત | - | તરફદારી             |
| 5) | અશક્ત   | - | નબળું               |
| 6) | તસ્દી   | - | તકલીફ               |
| 7) | કોકો    | - | એક ઝાડના બીજની ભુકી |
| 8) | ડોકું   | - | ગરદન                |

## સ્વાધ્યાય

### ➤ સાહિત્ય

પ્ર-1 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.

- 1) ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે?  
જ) ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે.
- 2) લેખકને આવકાર આપતાં સદગૃહસ્થ ક્યું વાક્ય બોલે છે?  
જ) લેખકને આવકાર આપતાં સદગૃહસ્થ આ વાક્ય બોલે છે: “ ઓહો! આજ કંઈ આ તરફ ? કેમ તબિયત તો સારી છે ને?”
- 3) લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું?  
જ) લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું, કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોય ગુમાવશે.

પ્ર-2 નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર જવાબ લખો.

- 1) લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી?  
જ) લેખકને પેલા સજ્જન વિશેની એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઈંદ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે.
- 2) લેખક સજ્જનને મળે છે તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી?  
જ) લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને એ સજ્જનના કાન શરદીના કારણે વધારે અશક્ત બન્યા હતા.

- ૩) સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું?
- ૪) લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે લેખકને પૂછે છે કે કેમ તબિયત તો સારી છેને ? ત્યારે સજ્જન કંઈક અલગ જ જવાબ આપે છે ત્યારે લેખકને ખબર પડે છે કે જરૂર સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે.

➤ વ્યાકરણ

સંજ્ઞા -

- ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો.
- હિમાલય સૌથી ઊંચો પર્વત છે.
- સત્યનો હંમેશા વિજય થાય છે.

ઉપરના વાક્યોમાં ગાંધીજી, હિમાલય, સત્ય વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે. આવા શબ્દો ' સંજ્ઞા ' તરીકે ઓળખાય છે.

પ્ર-૩ નીચેના શબ્દોની જોડણી સુધારો.

- |           |   |        |            |   |         |
|-----------|---|--------|------------|---|---------|
| ૧) ગૃહસથ  | - | ગૃહસ્થ | ૨) સ્થીતી  | - | સ્થિતિ  |
| ૩) તબિઅત  | - | તબિયત  | ૪) સૂલોચના | - | સુલોચના |
| ૫) નિચ્છય | - | નિશ્ચય |            |   |         |

પ્ર- ૪ નીચેનાના સમાનાર્થી શબ્દો લખો.

- |          |   |        |            |   |         |
|----------|---|--------|------------|---|---------|
| ૧) ખબર   | = | જાણ    | ૨) પક્ષપાત | = | તરફદારી |
| ૩) તસ્દી | = | તકલીફ  | ૪) આનંદ    | = | ખુશી    |
| ૫) આખરે  | = | છેલ્લે | ૬) ઉતાવળ   | = | જલ્દી   |

પ્ર-૫ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ( ' કુ ' અથવા ' અ ' )

- |          |   |        |          |   |         |
|----------|---|--------|----------|---|---------|
| ૧) શક્તિ | x | અશક્તિ | ૨) વિચાર | x | કુવિચાર |
|----------|---|--------|----------|---|---------|

3)	સત્ય	X	અસત્ય	4)	પાત્ર	X	કુપાત્ર
5)	ટેવ	X	કુટેવ	6)	શક્ય	X	અશક્ય
7)	સંપ	X	કુસંપ	8)	સંગ	X	કુસંગ

પ્ર-7 નીચેનીખાલી જગ્યા પૂરો.

- 1) તે દિવસે હવામાં શરદી હતી. ( દવા, હવા )
- 2) તમે યા નથી પીતાતે ઘણું સાડું. ( પિતા, પીતા)
- 3) આ ઘર તમને ફાવે છે કે નહિ? ( ઘર, ઘર )
- 4) કેમ તબિયત તો સારી છે ને? ( શારી, સારી )

પ્ર-8 કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો.

( નો, ની, નું, નાં, ને )

- 1) એ વાત ----- મને ખબર નહોતી.
- 2) મારા કંઠ માટે શરદી ----- પક્ષપાત છે.
- 3) આપ ----- જરા કામ હતું.
- 4) કોફી ----- પણ અત્યારે વાંધો નથી.
- 5) તે ----- માટે મેં શું નથી કર્યું?
- 6) તેમ ----- ઘર પછી ગયાં છે.

પ્ર-9 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

- 1) ટેવ, ઈંદ્રિય, શરદી ઉઘરસ, ભૂલ .
- જ) ઈંદ્રિય, ઉઘરસ, ટેવ, ભૂલ, શરદી .

➤ પ્રવૃત્તિ

તમને શરદી થાય ત્યારે ક્યા- ક્યા ઉપચાર કરશો? નોટબુકમાં લખો.